



# Gujarat Public Service Commission

## List of Eligible Candidates for Interview (Partial Modification)

Advertisement No. 44/2018-19

વંચાણે લીધી : આયોગની તા. 13.02.2019 ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી તથા આયોગની તા: 20.05.2019ની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદી.

1. આચાર્ય, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-2 ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક:44/2018-19 ના સંદર્ભમાં આયોગ દ્વારા તા.25.11.2018ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગની ઉપર વંચાણે લીધેલ યાદીઓથી અરજી ચકાસણીને પાત્ર કુલ: 346 ઉમેદવારોના બેઠક નંબરોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. ત્યારબાદ અરજી ચકાસણીને અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર થતા કુલ: 175 ઉમેદવારોની યાદી આયોગની કચેરી દ્વારા તા.20.05.2019 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.
2. આયોગની કચેરી દ્વારા તા.20.05.2019ની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીમાં બેઠક ક્રમાંક 101001963, 101004589 અને 101003121 પરના ઉમેદવારના અરજીપત્રકની ચકાસણી (Scrutiny) મુજબ તેઓ નિયત પ્રકારનો અનુભવ ધરાવતાં ન હોવાથી રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ગણવામાં આવેલ હતા.
3. અનુભવ બાબતે ઉમેદવારોની રજુઆત ધ્યાને લઈ સંદર્ભે પુનઃ વિચારણા કરતાં ઉક્ત બેઠક ક્રમાંક 101001963, 101004589 અને 101003121ના ઉમેદવારોનો અનુભવ માન્ય ગણવા અંગે નિર્ણય થયેલ છે. તદનુસાર, આ ઉમેદવારો જાહેરાતની જોગવાઈ પરિપૂર્ણ કરે છે.
4. આયોગના તા.14.10.1986ના કચેરી હુકમથી નિયત થયેલ માપદંડ મુજબ પોતાની સંબંધિત કેટેગરીમાં રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની નિયત થયેલ સંખ્યા મુજબ જો આ ઉમેદવારોનો મેરીટ યાદી મુજબ સમાવેશ થતો હોય તો તેઓને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવાના રહે છે.

5. અનુસંધાને, બેઠક ક્રમાંક **101001963** અને **101004589** જાહેરાતની જોગવાઈ પરિપૂર્ણ કરે છે તેમજ નિયત લાયકી ધોરણ પણ ધરાવતા હોવાથી રૂબરૂ મુલાકાત માટે પાત્ર થાય છે. જ્યારે આયોગના તા.14.10.1986ના કચેરી હુકમથી નિયત થયેલ માપદંડ મુજબ પોતાની સંબંધિત કેટેગરીમાં ઉક્ત બેઠક ક્રમાંક ધરાવતા બે ઉમેદવારોનો સમાવેશ થવાથી નિયત થતા ઉચ્ચ લાયકી ધોરણ મુજબ સંબંધિત કેટેગરીની મેરીટ યાદીના છેલ્લા ક્રમાંકના બેઠક ક્રમાંક **101002436** અને **101001877** નિયત લાયકી ધોરણ ન ધરાવતા હોવાથી રૂબરૂ મુલાકાત માટે અપાત્ર બને છે.
6. બેઠક ક્રમાંક **101003121** જાહેરાતની જોગવાઈ પરિપૂર્ણ કરે છે પરંતુ, પોતાને સંબંધિત કેટેગરીમાં નિયત થયેલ લાયકી ધોરણ ધરાવતા ન હોવાથી રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી.
7. ઉપરોક્ત હકીકતને અનુલક્ષીને આયોગની કચેરી દ્વારા તા.20.05.2019 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના બેઠક નંબરની યાદીમાં નીચે મુજબ અંશતઃ સુધારો કરવામાં આવે છે.
  - I. રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદીમાં બેઠક ક્રમાંક **101001963** અને **101004589** નો સમાવેશ કરવામાં આવે છે. તથા નોંધ (1) હેઠળની યાદીમાંથી તેમને રદ કરવામાં આવે છે. નોંધ (1) હેઠળની યાદીમાં હવે રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ઉમેદવારોની સંખ્યા **14** વંચાણે લેવાની રહે છે.
  - II. રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદીમાંથી બેઠક ક્રમાંક **101002436** અને **101001877**ને રદ કરવામાં આવે છે. તથા નોંધ (2) “જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરે છે, પરંતુ આયોગે રૂબરૂ મુલાકાત માટે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing Standard) ધરાવતા ન હોઈ રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી” માં સમાવેશ કરવામાં આવે છે.
  - III. બેઠક ક્રમાંક **101003121**નો નોંધ (3) હેઠળની યાદીમાંથી રદ કરીને નોંધ (૨) હેઠળની યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. નોંધ (3) હેઠળની યાદીમાં હવે રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ઉમેદવારોની સંખ્યા **22** વંચાણે લેવાની રહે છે.

IV. બેઠક ક્રમાંક **101002436, 101001877 અને 101003121**નો નોંધ (ર) હેઠળની યાદીમાં સમાવેશ થવાથી નોંધ (ર) હેઠળની યાદીમાં હવે રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ઉમેદવારોની સંખ્યા **135** વંચાણે લેવાની રહે છે.

8. આયોગની કચેરી દ્વારા તા.20.05.2019 ના રોજ પ્રસિધ્ધ થયેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહેશે.

સ્થળ: ગાંધીનગર-382010

તારીખ: 21.05.2019

(સંયુક્ત સચિવ)

ગુજરાત જાહેર સેવા આયોગ